



પ્રેસનોટ- ૦૨

તા. ૨૧/૦૨/૨૦૨૧

લોકશાહીના પર્વમાં સૌ મતદાર ભાઈઓ વધુમાં વધુ
પોતાના મતાધિકારનો ઉપયોગ કરે - શ્રી સી. આર. પાટીલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સ્થાનિક સ્વરાજ્યને
ખૂબ મહત્વ આપતાં રહ્યાં છે - શ્રી સી. આર. પાટીલ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ગુજરાતના ૧૪ વર્ષના કાર્યકાળમાં
જનકલ્યાણના વિવિધ કાર્યો થકી અને વિકાસની કેડી કંડેરીને
એક "સફળ વિકાસ મોડેલ ગુજરાત મોડેલ"ને દેશ તેમજ દુનિયા સમક્ષ મૂક્યું છે - શ્રી સી. આર. પાટીલ

ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલે પરિવાર સહિત વોર્ડ નં. ૨૦ના બુથ નં. ૮૪, રૂમ નં. ૧૧, શાળા નં. ૪૫-૪૬, એન. પી. એસ. સમિતિ સંચાલિત મિશ્ર સ્કૂલ, રાજકુમાર સિનેમા, ગુજરાત હાઉસીંગ બોર્ડ, ખડોદરા, સુરત ખાતે મતદાન કર્યું હતું. મતદાન પછી મિડીયાના મિત્રો સાથે વાતચિત કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીના પર્વમાં સૌ મતદાર ભાઈઓ વધુમાં વધુ પોતાના મતાધિકારનો ઉપયોગ કરે, કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરી ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં વધુમાં વધુ મતદાન કરવાની અપીલ શ્રી પાટીલે કરી હતી.

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી હંમેશા સ્થાનિક સ્વરાજ્યને ખૂબ મહત્વ આપતાં રહ્યાં છે. રાજ્યના નાનામાં નાના એકમ ગ્રામ પંચાયતથી લઈ વિધાનસભા-લોકસભાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ એક સાથે એક દિશામાં કાર્યમાં કોઇપણ જાતના પક્ષપાત સિવાય જોતરાઈ જાય તો કોઇ પણ રાજ્યમાં અવિરત વિકાસ થઈ શકે છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં તેમના ૧૪ વર્ષના કાર્યકાળમાં જનકલ્યાણના વિવિધ કાર્યો થકી અને વિકાસની કેડી કંડેરીને એક "સફળ વિકાસ મોડેલ ગુજરાત મોડેલ"ને દેશ તેમજ દુનિયા સમક્ષ મૂક્યું છે. આજે દુનિયા માટે એ રીસર્ચનો વિષય છે કે, આટલા ટૂંકા ગાળામાં એક રાજ્યનો કેટલો વિકાસ થઈ શકે તે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પારદર્શક પ્રશાસન થકી વિશ્વ સમક્ષ મૂક્યું છે.

ડૉ.યજ્ઞેશ ઢવે
પ્રદેશ મીડિયા કન્વીનર,